

ક્રમાંક:સતમસુ/હિસાબી/ /૨૦૨૫

તા. 18/12/૨૦૨૫

28058-90

ખુબજ અગત્યનું :-

પરિપત્ર:-

અત્રેની સંસ્થા ખાતે ફરજ બજાવતાં તમામ અધિકારી/કર્મચારીને જણાવવામાં આવે છે કે, ચાલુ નાણાંકીય વર્ષ ૨૦૨૫-૨૦૨૬ દરમ્યાન જે અધિકારી/કર્મચારીઓની આવક આવકવેરાને પાત્ર થતી હોય, તેવાં અધિકારી/કર્મચારીઓએ બચત/રોકાણની વિગતો આ સાથે સામેલ ઇન્કમ ટેક્સ ફોર્મ સાથે મોડામાં મોડી તા. ૩૧/૧૨/૨૦૨૫ સુધીમાં અત્રેની સંસ્થાના હિસાબી શાખામાં અચૂક મળી જાય તે રીતે મોકલી આપવા જણાવવામાં આવે છે.

જે અધિકારી/કર્મચારીઓનાં ઇન્કમ ટેક્સ ફોર્મ અને બચત/રોકાણ કર્યા અંગેની જરૂરી પુરાવા જણાવેલ સમય દરમ્યાન મળશે નહીં, તો તેવા અધિકારી/કર્મચારીઓએ બચત/રોકાણ કરેલ નથી, તેમ માની લઈ કપાત કરવા પાત્ર આવકવેરો માહે-ફેબ્રુઆરી-૨૦૨૬નાં પગાર માંથી કપાત કરી લેવામાં આવશે.

Self-assessment statement (Income Tax form) માં દર્શાવ્યાં મુજબની બચત/રોકાણ અચૂકપણે ચાલુ નાણાંકીય વર્ષ ૨૦૨૫-૨૦૨૬ દરમ્યાન રજુ કરવાનું રહેશે. જો તેમ કરવામાં જે-તે અધિકારી/કર્મચારી કસુર કરશે તો ઇન્કમ ટેક્સ કપાત અંગેની જવાબદારી અત્રેની સંસ્થાની રહેશે નહીં.


વધુમાં જણાવવામાં આવે છે કે, કેટલાંક અધિકારી/કર્મચારી બચત/રોકાણ કરશે તેમ જણાવે છે, ત્યાર બાદ આવું રોકાણ કરવામાં આવતું નથી, જેને કારણે કપાત કરવાપાત્ર થતા આવકવેરાની કપાત નહિ થવાથી આવકવેરા વિભાગ તરફથી કારણદર્શક નોટીસ આપવામાં આવતી હોય છે, તેમજ સંસ્થા નામે ઇન્કમ ટેક્સ ઓછા ભરાયા અંગેની ડિમાન્ડ ઉભી થતી હોય છે. માટે જે-તે અધિકારી/કર્મચારીઓએ બચત/રોકાણનાં પુરાવાં મોડામાં મોડા તા ૦૫/૦૧/૨૦૨૬ સુધીમાં અત્રેની સંસ્થાની હિસાબી શાખામાં રૂબરૂમાં આવી જમા કરવાનાં રહેશે. જો ફોર્મ જમા કરાવવામાં નહીં આવશે તેવા અધિકારી / કર્મચારીઓનો માહે ફેબ્રુઆરી-૨૦૨૬ થી પગાર આકારવામાં આવશે નહીં Income Tax ની કપાત થશે નહીં તે અંગેની જવાબદારી જે તે અધિકારી / કર્મચારીની રહેશે.

વધુમાં તમામ અધિકારી/કર્મચારીઓને જણાવવામાં આવે છે કે, માસિક પગારમાંથી કપાત કરવામાં આવતી GPF /CPF ની રકમ ૧૨ માસની ગણતરી કરતા GPF માં Rs. 5,00,000/- થી વધુ અને CPF માં Rs. 2,50,000/- થી વધુ રકમ જમા થશે જે રકમ Taxable ગણાશે.

જે-તે અધિકારી/કર્મચારીઓએ પાનકાર્ડની ક્ષેરોક્ષ નકલ પત્રક **Income Tax form** સાથે સામેલ કરવાની રહેશે. જે અધિકારી/કર્મચારીઓએ પાનકાર્ડ સામેલ ન કરેલ હશે, તેઓને ફોર્મ-૧૬ આપવામાં આવશે નહીં. જેની સર્વે અધિકારી/કર્મચારીઓએ નોંધ લેવી.

Income Tax Form તથા Employee દ્વારા P.F. માં યોગદાન કરવા બાબતે Income Tax દ્વારા નક્કી થયેલ નિયમો સંસ્થાની વેબ સાઈટ પર મુકવામાં આવેલ છે. જ્યાથી Download [https://start \[Government Medical College Surat\] \(gmcsurat.edu.in\)](https://start[Government Medical College Surat](gmcsurat.edu.in)) કરી હાર્ડ કોપીમાં જણાવેલ સમય મર્યાદામાં અત્રેની હિસાબી શાખામાં રજુ કરવાનું રહેશે. સમય મર્યાદાબાદ આવેલ Income Tax Form ના Tax બાબતની તમામ જવાબદારી જે તે અધિકારી / કર્મચારીઓની રહેશે.

ઉપરોક્ત પરિપત્રનો ચૂસ્તપણે અમલ કરવાનો રહેશે.



સરકારી તબીબી મહાવિદ્યાલય
સુરત.

નકલ રવાના : -

- પ્રાધ્યાપક અને વડાશ્રી, તમામ વિભાગ સ.ત.મ. સુરત તરફ જાણ તેમજ આપના વિભાગમાં ફરજ બજાવતા તમામ અધિકારી/કર્મચારીઓને ઉપરોક્ત પરિપત્ર અમલ થવા અંગે જરૂરી કાર્યવાહી થવા સારૂ.
- શાખા ઈન્ચાર્જશ્રી, તમામ શાખા સ.ત.મ. સુરત તરફ જાણ તેમજ આપની શાખામાં ફરજ બજાવતા તમામ કર્મચારીઓને ઉપરોક્ત પરિપત્ર અમલ થવા અંગે જરૂરી કાર્યવાહી થવા સારૂ.
- વોર્ડનશ્રી, તમામ હોસ્ટેલ, સ.ત.મ. સુરત તરફ જાણ તેમજ આપની શાખામાં ફરજ બજાવતા તમામ કર્મચારીઓને ઉપરોક્ત પરિપત્ર અમલ થવા અંગે જરૂરી કાર્યવાહી થવા સારૂ.

A STATEMENT OF SHOWING ANNUAL INCOME OF SALARY DURING THE YEAR 2025-2026 (F.Y.)

GOVERNMENT MEDICAL COLLEGE, SURAT

NAME :-										DESIG.:										
GP/ OR C.P.F. A/C. NO.:										I.TAX PAN CARD NO. :										
DEPARTMENT :										OFFICE TAN NO. : SRTG01499B										
MONTH / YEAR	SP. PAY	PAY BAND	DA	HRA	CLA	MA	UNI.ALL.	NUS.ALL.	MESS. / W.A.	B.A.	TA	GROSS TOTAL	I.TAX	HRR	P.TAX	SIS	GP/ CPF	PAY RECO.	LIC	NET AMT.
Mar-25	0	0	0	0	0	0	0	0	0	0	0	0	0	0	0	0	0	0	0	0
Apr-25	0	0	0	0	0	0	0	0	0	0	0	0	0	0	0	0	0	0	0	0
May-25	0	0	0	0	0	0	0	0	0	0	0	0	0	0	0	0	0	0	0	0
Jun-25	0	0	0	0	0	0	0	0	0	0	0	0	0	0	0	0	0	0	0	0
Jul-25	0	0	0	0	0	0	0	0	0	0	0	0	0	0	0	0	0	0	0	0
Aug-25	0	0	0	0	0	0	0	0	0	0	0	0	0	0	0	0	0	0	0	0
Sep-25	0	0	0	0	0	0	0	0	0	0	0	0	0	0	0	0	0	0	0	0
Oct-25	0	0	0	0	0	0	0	0	0	0	0	0	0	0	0	0	0	0	0	0
Nov-25	0	0	0	0	0	0	0	0	0	0	0	0	0	0	0	0	0	0	0	0
Dec-25	0	0	0	0	0	0	0	0	0	0	0	0	0	0	0	0	0	0	0	0
Jan-26	0	0	0	0	0	0	0	0	0	0	0	0	0	0	0	0	0	0	0	0
Feb-26	0	0	0	0	0	0	0	0	0	0	0	0	0	0	0	0	0	0	0	0
DA-1	0	0	0	0	0	0	0	0	0	0	0	0	0	0	0	0	0	0	0	0
DA-2	0	0	0	0	0	0	0	0	0	0	0	0	0	0	0	0	0	0	0	0
DA-3	0	0	0	0	0	0	0	0	0	0	0	0	0	0	0	0	0	0	0	0
NPPA DIFFRENC E 5th int.	0	0	0	0	0	0	0	0	0	0	0	0	0	0	0	0	0	0	0	0
HIGHER GRADE DIFFRENC E	0	0	0	0	0	0	0	0	0	0	0	0	0	0	0	0	0	0	0	0
PAY DIFFRENC E	0	0	0	0	0	0	0	0	0	0	0	0	0	0	0	0	0	0	0	0
LTC 10 DAYS	0	0	0	0	0	0	0	0	0	0	0	0	0	0	0	0	0	0	0	0
TOTAL	0	0	0	0	0	0	0	0	0	0	0	0	0	0	0	0	0	0	0	0
										(-) PAY RECOVERY:-->										
										0										
										0										

(-) PAY RECOVERY :---->
NET AMOUNT :----->

ACCOUNTS OFFICER
GOVERNMENT MEDICAL COLLEGE
SURAT

(SIGNATURE OF EMPLOYEE)

FINAL COMPUTATION OF INCOME TAX FOR F.Y.-2025-26 (A.Y.2026-27) (NEW SCHEME)				
GOVERNMENT MEDICAL COLLEGE, SURAT.				
NAME :		DEPARTMENT :		
GPF OR C.P.F. A/C No. :		I.TAX PAN NO. :		
DESIG. :		BILL NO./SR.NO. :		
1. GROSS SALARY FROM THIS INSTITUTE:-	=	-		
1A. GROSS SALARY FORM OTHER INSTITUTE:-	=	0		
1B. (Less) PAY RECOVERY FROM PAY BILL :-	=	0		
1C. (Add) CPF(GOVERNMENT'S SHARE):-	=			
2. TOTAL SALARY = (1+1A)-(1B)+(1C) :-				0
3. Less: STANDARD DEDUCTION				75000
4. TAXABLE SALARY (2) -(3)				-75000
3. ANY OTHER INCOME :-				
(A) Bank Interest & Other Income		0		
4. GROSS TOTAL INCOME (2 + 3 (A)) :-				-75000
5. DEDUCTION U/S 80CCD(2) EMPLOYER CONTRIBUTION TO NPS UPTO 14%				0
6. NET TAXABLE INCOME (ROUNDED IN NEAREST OF RS.10) :- (4)-(5)				-75000
7. TOTAL INCOME TAX ON NET TAXABLE INCOME :-				FALSE
8. Less:-60000/- U/S 87-A (If Net Taxable Income Less than Rs.12,00,000/-):-				FALSE
9. NET INCOME TAX (7-8) :-				0
10. Surcharge 10% if taxable income exceeds Rs.50 Lakhs				0
11. Total Tax plus Surcharge (9)+(10)				0
12. 4% EDUCATION CESS ON NET INCOME TAX + SC +EC :-				0
13. TOTAL INCOME TAX (11 + 12) :-				0
			-: FOR MALE & FEMALE :-	
(A) As per Col. No.10, If Net Taxable Income upto Rs.4,00,000/-			Nil	
(B) Between Rs.4,00,001/- To Rs.8,00,000/-			5%	
(C) Between Rs.8,00,001/- To Rs.12,00,000/-			10 % + 20000/-	
(D) Between Rs.16,00,001/- To Rs.20,00,000/-			15 % + 60000/-	
(E) Between Rs.16,00,001/- To Rs.20,00,000/-			20 % + 120000/-	
(E) Between Rs.20,00,001/- To Rs.24,00,000/-			25 % + 200000/-	
(F) Above Rs.24,00,001/-			30 % + 300000/-	
15. Income Tax already Ded. From Salary of 3/2025 to 01/2026 :----->				0
16. Self Advance Income Tax Paid :- Challan No. & Date : / /20				0
17. Income Tax Ded. From Salary of 02/2026 :----->				0
18. Total Income Tax (15 + 16 + 17) :----->				0
19. Tax Payable(+) OR Refundable (-) (13 -18) :----->				0
ACCOUNTS OFFICER GOVERNMENT MEDICAL COLLEGE SURAT OFFICE TAN NO.:- SRTG01499B		All above information are true and correct		
		(SIGNATURE OF EMPLOYEE)		
		Mobile No:-		

Note: From A.Y.2024-25 the default scheme will be new tax regime and only new tax regime opted fill this form , if old tax regime opted than kindly fill form of old tax regime

FINAL COMPUTATION OF INCOME TAX FOR F.Y.-2025-26 (A.Y.2026-27) (OLD TAX REGIME)			
GOVERNMENT MEDICAL COLLEGE, SURAT.			
NAME :		DEPARTMENT :	
GPF OR C.P.F. A/C No. :		I.TAX PAN NO. :	
DESIG. :		BILL NO./SR.NO. :	
1. GROSS SALARY FROM THIS INSTITUTE:-			-
1A. GROSS SALARY FORM OTHER INSTITUTE:-		0	
1B. (-) PAY RECOVERY FROM PAY BILL :-		0	
2. TOTAL SALARY IN YEAR (1+1A-1B)			0
3. CPF (Government's Share) :-		0	
4. TOTAL (2+3)			0
5. ALLOWANCE TO THE EXTEND EXEMPTED :-			
(5.A) Professional Tax (U/S.16(ia))			
(5.B) Standered Deduction U/S 16(i) (Rs.50,000/-)		50000	
6. Total (5.A+5.B)			50000
7. NET SALARY INCOME (4-6) :-			-50000
8. OTHER INCOME:			
(A) Bank Interest & Other Income		0	
9. TOTAL INCOME (7+8)			-50000
10. DEDUCTION UNDER CHAPTER – VI-A :-			
(1) Permanent Disability U/S.80U (Max Rs. 75000/-)		0	
(2) Mediclaim Insurance Premium U/S.80 D (Max Rs. 25000/-) + Dependent parents if not senior citizen Rs. 25000/- and dependent parents is senior citizen then Max Rs.50000)			
(3) HBA Interest U/S.24B (i) (iv) (Maxi.2,00,000/-) (on or after 01/04/1999)			
(4) Higher Education Loan Interest U/S.80E		0	
(5) Medical Treatment of Handicapped dependents U/S 80-DD (Max.Rs.75000/-)		0	
11. TOTAL DEDUCTION UNDER CHAPER -VI-A (1 TO 5)			0
12. TOTAL INCOME (9-11) :-			-50000
13. DEDUCTION U/S.80-C (Maxi.Rs.150000) (From : 4/2025 TO 3/2026) :-			
(1) G.P.F.		0	
(2) C.P.F. (U/S. 80 CCD (1))		0	
(3) P.P.F.		0	
(4) LIC Premium		0	
(5) N.S.C. Deposit		0	
(6) N.S.C. Interest re-invested		0	
(7) Housing Loan Principal Amt.		0	
(8) Deposit in 10 Year, 15 Year Account under P.O. Saving Band (CTD)		0	
(9) State Group Insurance		0	
(10) ULIP / Equity Link Saving Fund		0	
(11) Investment in Pension Fund		0	
(12) PLI Premium		0	
(13) Education Fees (Tution/Education Fee Only/Up to 2 Children)		0	
14. TOTAL INVEST. U/S.80-C (MAX RS.1,50,000) {1 to 13} :-			0
15. DEDUCTION U/S.80-CCD (1B) (Maxi.Rs.50000) (From:-4/25 to 3/26) CPF (Emplayee's Share) OR Investment in NPS individual :-		0	
16. TOTAL INVEST. U/S.80-C + CCD (1B) (MAX RS.2,00,000) {14+15} :-			0
17. CPF (Government's Share) U/S. 80 CCD (2) (Maximum 14% of Basic+DA)		0	
18. NET TAXABLE INCOME (ROUNDED IN NEAREST OF RS.10) (12-16):-			-50000

GOVERNMENT MEDICAL COLLEGE, SURAT.

...2...

...2...

19. TOTAL INCOME TAX ON NET TAXABLE INCOME :-		0
20. Less:-12,500/- U/S 87-A (If Net Taxable Income Less than Rs.5,00,001/-):-		0
21. ADD SC 10% IF TOTAL INCOME MORE THAN 50LAKS		0
22. TOTAL TAX (19-20+21)		0
23. 4% EC ON 22		0
24. TOTAL INCOME TAX (22+23)		0
:- FOR MALE & FEMALE :-		
(A) As per Col. No.11, If Net Taxable Income upto Rs.2,50,000/-		Nil
(B) Between Rs.2,50,001/- To Rs.5,00,000/-		5%
(C) Between Rs.5,00,001/- To Rs.10,00,000/-		20 % + 12500/-
(D) Above Rs.10,00,001/-		30 % + 112500/-
:- FOR SENIOR CITIZEN :-(Age Morethan 60)		
(A) As per Col. No.11, If Net Taxable Income upto Rs.3,00,000/-		Nil
(B) Between Rs.3,00,001/- To Rs.5,00,000/-		5%
(C) Between Rs.5,00,001/- To Rs.10,00,000/-		20 % + 10000/-
(D) Above Rs.10,00,001/-		30 % + 110000/-
25. Income Tax already Ded. From Salary of 3/2025 to 01/2026 :-		0
26. Self Advance Income Tax Paid :- Challan No. & Date : / /20 .		0
27. Income Tax Ded. From Salary of 02/2026 :-		0
28. Total Income Tax (24+25+26) :-		0
29. Tax Payable (+) OR Refundable (-) (24-28) :-		0
All above information are true and correct		
(SIGNATURE OF EMPLOYEE)		
ACCOUNTS OFFICER		
GOVERNMENT MEDICAL COLLEGE		
SURAT		
OFFICE TAN NO.:- SRTG01499B		Mobile No:-

Note: This form to be filled only if old tax regime is opted , If new tax regime is opted than other form should be filled